## **ASHNISHA INDUSTRIES LIMITED**

23rd January, 2024

To,

Department of Corporate Services

BSE Limited

Ground Floor, P. J. Towers,

Dalal Street, Fort,

Mumbai- 400 001

Security ID: <u>ASHNI</u> Security Code: <u>541702</u>

Sub: Copy of Advertisement of Unaudited Financial Results for the quarter ended on 31st December, 2023.

Dear Sir/Madam,

Please find enclosed herewith copy of Advertisement of Unaudited Financial Results for the quarter ended on 31<sup>st</sup> December, 2023 as per Regulation 47(1)(b) and 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking You,

Yours faithfully,

For Ashnisha Industries Limited

Ashok C. Shah Managing Director DIN: 02467830

Encl: As above






The appearance of this article straddles the Bangladesh election held earlier this month and the forthcoming general election in Pakistan. There is, however, a wider context. It is estimated that in 2024, some 80 elections would take place impacting some four billion people — about half the world's

South Asia is well-represented in this list. Bhutan and Bangladesh have already had their national elections in the first half of January. The Pakistan national election is scheduled for February 8. General elections in India are expected in April-May and the Sri Lankan election will follow later in the year. The Maldives' general election in the last guarter of 2023 started the trend: its outcome was significant in that the change of government the elections threw up has been accompanied by a significant rebalancing of its external posture.

Commentary on the Bangladesh election was generally unanimous on one point: the ruling Awami League's convincing win and the return of Sheikh Hasina Wajed for a fifth term as prime minister were entirely predictable. A significant part of Bangladesh's Opposition boycotted the election; many were in custody. Some countries, particularly the United States of America, alleged that the election was not 'free or fair'. The United Nations High Commissioner for Human Rights also expressed his concerns. But other countries, including India, have accepted the results and congratulated Prime Minister Sheikh Hasina Waied on her victory.

A somewhat similar situation is visible in Pakistan. The former prime minister, Imran Khan, is in jail. He has been barred from contesting the polls and his party has faced a systemic decimation over the past year. This is not unusual for Pakistan. At the time of the 2018 election, much the same set of events occurred except that in the crosshairs then were the former prime minister, Nawaz Sharif, and his party. Sharif's disqualification for life from politics has been reversed only now. In Pakistan, the twists and turns in civil-military relations and the role of the army usually underwrite explanations of its politics. But in Bangladesh too, in 2018, the election was largely a one-sided and predictable affair: the Opposition boycotted it and many of the principal leaders were barred from contesting the polls or were in custody. In Pakistan, not everyone agrees, despite indications to the contrary, that Sharif's victory is fully assured. The country is awash with rumours and uncertainty, anticipating some last-minute change in the army's political calculations.

# A new chapter



pratishtha — loosely transdeity of Lord Rama in the new 22 has, quite predictably, triga reasonable body of literature in the English language on the subject, but these works tend to have been journalists intent on demonstrating that the Ram temple movement and the associated Hindutva sentiment posed a grave danger to the democratic soul of India. In the aftermath of the demolition of the Ram Janmabhoomi movethe Babri structure on December 6, 1992, countless seminars and meetings were tion. The stereotype of frenhosted globally — large numbers of them bankrolled by the led by itinerant godmen with then Government of India to dissect the descent into barbarism and evolve strategies to defeat the threat. Additionally, little or no space was given to those who had alternative perspectives of the churning that began in India from the mid-1980s and persists to this day.

the history of the period that 1992. Those with long memothe celebrated lawyer, Nani Palkhivala, once described as that was sought to be whipped the "Ayodhya years" will naturally find the published material woefully one-sided. The electronic media was then in its infancy and mainly government-controlled. True, there was, predictably, forbidden were two or three video magazines run by established media houses, but even those were inclined to mirror the would demolish all Muslim proclivities of the Englishspeaking intelligentsia. An easily accessible example of the workers and leaders tried to mood among the horrified march symbolically to the members of the ancien régime in the week after the Gate, they were greeted with demolition of the Babri struc- water cannons. What was furture is an uploaded copy of ther interesting was that the the Eyewitness video magazine, now available on was cheered by members of YouTube. Members of a the 'secular' press corps.

The scheduled pran younger generation, familiar with today's adulatory media lated as consecration — of the coverage of the run-up to the grand ceremony next Monday, temple in Ayodhya on January will be struck by the censorious tone of the commentargered a wave of interest in ies on the demolition of the the movement that facilitated disputed structure over three the construction of the bhavya decades ago. They will find it mandir. No doubt there exists difficult to reconcile the dignified traditionalism and the hitech environment of today's Ayodhya with the images of frenzied kar sevaks assaulting mainly written by scholars and a medieval structure with small knives, shovels and, often, with their bare hands.

Their consternation would

be justified. For a very long

time, the dominant media narrative in India sought to paint ment as antediluvian and unworthy of a modern civilisazied 'natives' in their dhotis. dreadlocks and flowing saffron robes that used to petrify the ruling elite in the cantonments and Civil Lines after the 1857 mutiny, made a comeback, first during the Ram shilan pujas in 1988-89, then, during L.K. Advani's rath yatra and the bloody kar seva of 1990 and, finally, during the Those trying to recreate demolition on December 6, ries may recall the hysteria up by the then ruling elite when the Bharatiya Janata Party announced a rally at New Delhi's Boat Club lawns in February 1993. The rally and the Boat Club lawns covered with concertina wires on the grounds that the protestors places of worship along the way. When small groups of BJP sealed venue around India police action on the leaders

# Looming polycrisis Taiwan just inflicted a crushing ideological defeat on China; future of Xi Jinping's 'unification' plan looks bleak

dential elections in Taiwan were many things to many people. For the United States, a victory for the current vice president Lai Ching-te, or William Lai, of the pro-Independence Democratic Progressive Party is a win for the right man and a defiant rebuke ever, that for the first time to Beijing. To the Chinese Communist Party, it is the coming to power of a "dangerous separatist". To one section of voters in Taiwan, it a mandate to continue with the policies mainstreamed by outgoing president Tsai Ingwen, while for another section it is an expression of dissatisfaction with the current order the Parliament, Lai may find it of things.

cross narratives, it is worth taking a closer look at the results. The DPP, which rejects China's territorial claims, resists unification and promotes a Taiwanese national identity, received the mandate for an unprecedented third successive presidential term.

However, president-elect Lai could only get 40 per cent of the polled vote, down from 50 per cent that Tsai had se-

The recently held presi- when she received the backing of eight million voters. Hou Yu-ih of Kuomintang, the Beijing-friendly main Opposition, secured 33.5 per cent and Ko Wen-je of the upstart Taiwan People's Party (TPP) won 26.5 per cent votes.

Interesting to note, howsince 2004, none of the parties won a majority in Taiwan's Legislative Yuan. The loss here is stark for the DPP that came down from 62 to 51 legislative seats in the 113-seat Yuan, suffering a net loss of 11 seats. The KMT got 52 and the TPP, eight.

With DPP losing majority in difficult to push legislation Before we analyse these through. The KMT and TPP, whose pre-poll alliance efforts fell through, may join hands to cross the magic figure of 57 and call the shots, and they may start by preventing the DPP from retaining the speakership. Now, regardless of the

possibilities that this result throws up, the act of holding the elections itself is pregnant with symbolism.

Starting from 1996 when

**ASHNISHA INDUSTRIES LIMITED** 

Registered Office. 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital,

Mithakhali Six Roads, Ahmedabad 380 006. CIN:L74110GJ2009PLC057629 STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2023 ( Rs. In La

polls took place, people of Taiwan have consistently been taking part in large numbers in all electoral exercises. The turnout touched 71 per cent this time with 14 million voters casting their ballot, staring down bullying, coercion, disinformation campaigns, cyber and psychological warfare from the Chinese Communist Party that interprets elections as a mutinous act of insubordination and leaves no stone unturned to leave Taiwan diplomatically isolated.

In some ways, therefore, the simple act of voting in Taiwan, held at the barrel of the CCP's gun, is much more than an electoral exercise. It is both cured in 2020 in a landslide the first direct presidential an act of affirmation and ne-

( Rs. In Lakhs)

gation. It is an affirmation of ese people have struck at the nomic model that works. democracy and a negation of China's main ideological plank. Voters in Taiwan sent two core messages by taking part in the celebration of democracy and choosing their leaders through free and fair elections. One, they haven't bowed down to China's threats of reunification as an inevitability, and while not seeking to be confrontational, have chosen to invest in their future. This demonstrates the audacity of hope. Two, the Taiwan-

very root of Communist China's propaganda that Chinese people do not yearn for political freedom and are ready to exchange it for prosperity and stability. The people of Taiwan have smashed the Chinese Communist Party's ideological plank that democracies are chaotic, corrupt and inefficient, and authoritarian partystate is the only system that may provide effective governance to the people by way of ensuring a political and eco-

Just by its act of existing as a throbbing, thriving democracy that ensures freedom, well-being and growth to its people, therefore, Taiwan poses an existential challenge to the Chinese Communist Party's formidable propaganda machine. Considered one of the "most free" democracies in the world, Taiwan is one of the wealthiest countries in Asia with per capita GDP of \$32,679 in 2022 compared to China's \$12,734.



### **PIRAMAL CAPITAL & HOUSING FINANCE LTD** (Formerly Known as Dewan Hou CIN:L65910MH1984PLC032639

Regional Office: HDIL Towers, Ground Floor, Anant Kanekar Marg, Station Road, Bandra (East), Mumbai- 400051, Maharashtra.

Registered Office: Unit No-601, 6th Floor, Piramal Amiti Building, Piramal Agastva Corporate Park, Kamani Junction, Opp. Fire Station, LBS Marg, Kurla (West)

FLAT

FLAT

K-L Type

K-L Type

Whereas, the undersigned being the Authorized Officer of Piramal Capital & Housing Finance Ltd. (Formerly Known as Dewai Housing Finance Corporation Ltd) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Securit nterest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement Rules 2002, Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned nerein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrowe naving failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of the Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement rules, 2002. The borrower attention is invited to provisions of sub—section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Piramal Capital & Housing Finance Ltd. (Formerly Known as Dewan Housin

Sr. Name of the Borrower(s)/ No. Guarantor(s)	Description of Secured Asset (Immovable Property)	Demand Notice Date and Amount	Date of Possession
(Loan Code No. 00004768 )/ (Surat Branch) 1. Radhika Constructions (Borrower) 2. Kanmleshbhai Bhesaniya (Guarantor / Partner of Borrower Firm) 3. Rameshkumar Kathiriya (Guarantor / Partner of Borrower Firm) 4. Ashokbhai Patel (Guarantor Partner of Borrower Firm) 5. Navinchandra Topiya (Guarantor / Partner of Borrower Firm) 6. Mr. Kapilkumar Rank (Guarantor)	(Description of the Mortgaged property) Pari passu charge on all that piece and parcel of the land and project "Radhika Homes" bearing Block No. 213, Revenue Survey No, 141, O. P. No. 17, F. P. No 17/Paikee, Sub Plot No.2, admeasuring 7967 sq.mtrs Draft T.P.S No. 62 (Dindoli Bhestan - Bhedwad), Village-Dindoli, Surat City, Dist-Surat, along with present and future unsold construction thereon which is more particularly described in Annexure I and II written hereunder. Units which are described in Annexure III written hereunder are hypothecated with PCHFL	03-10-2023/ Rs. 8,07,62,515.34/- (Rupees Eight Crore Seven Lakhs Sixty Two Thousand Five Hundred Fifteen and Thirty Four Paisa only)	18.01.2024

Nav Part	ner of Borrower Fir inchandra Topiya (C ner of Borrower Fir Ir. Kapilkumar Rank	Guarantor/ rm)	Annexure I and II ware described in An are hypothecated v	ore particularly deso ritten hereunder. Ur nexure III written he vith PCHFL nexure I	nits which	Paisa only)			
List of Booked units/Flats Mortgaged and Hypothecated with PCHFL in project "Radhika Homes"									
SEINO	Type of Unit	Block	Building type	Flat 1 Shop No.		Saleable Area (sq ft)			
1	FLAT	A-B Type	A	204	673	1178			
2	FLAT	A-B Type	В	101	673	1178			
3	FLAT	C-D Type	С	103	670	1172			
4	FLAT	C-D Type	С	104	673	1178			
5	FLAT	C-D Type	С	201	635	1112			
6	SHOP	C-D Type	D	24	227	397			
7	FLAT	C-D Type	D	101	673	1178			
8	FLAT	E-F Type	E	303	632	1106			
9	FLAT	E-F Type	F	103	632	1106			
10	FLAT	E-F Type	F	204	410	717			
11	FLAT	E-F Type	F	501	410	717			
12	FLAT	J Type	J	101	593	1037			
13	FLAT	J Type	J	103	593	1037			
14	FLAT	J Type	J	104	593	1037			
15	FLAT	K-L Type	K	301	635	1112			
	TOT 4.00	77 Y W	77		1106				

Total	13507					
Annexure II						
List of Unsold units/Flats Mortgaged and Hypothecated with PCHFL in project "Radhika Hom						

632 632

813

1106 1106

1423

Sr.	Туре		Building	Flat /	Carpet	Saleable	Sr.	Туре		Building	Flat /	Carpet	Saleable
No	of Unit	Block	type	Shop No.	area (sq ft)	Area (sq ft)	No	of Unit	Block	type	Shop No.	area (sq · ft)	Area (sq ft)
1	SHOP	A-B Type	A	1	227	397	64	FLAT	E-F Type	F	302	632	1106
2	SHOP	A-B Type	A	2	227	397	65	FLAT	E-F Type	F	303	632	1106
3	SHOP	A-B Type	A	3	227	397	66	FLAT	E-F Type	F	403	632	1106
4	SHOP	A-B Type	Α	4	227	397	67	FLAT	G Type	G	103	593	1037
5	SHOP	A-B Type	A	5	227	397	68	FLAT	G Type	G	201	593	1037
6	SHOP	A-B Type	A	6	227	397	69 70	FLAT FLAT	G Type G Type	G G	202 204	593 593	1037 1037
7	FLAT	A-B Type	A	102	632	1106	71	FLAT	G Type	G	301	593	1037
9	FLAT	A-B Type	A	301	635 670	1112 1172	72	FLAT	G Type	G	303	593	1037
10	FLAT	A-B Type A-B Type	A A	303 402	632	1106	73	FLAT	G Type	G	401	593	1037
11	FLAT	A-B Type	A	404	673	1178	74	FLAT	G Type	G	402	593	1037
12	FLAT	A-B Type	A	501	635	1112	75	FLAT	G Type	G	404	593	1037
13	FLAT	A-B Type	Α	502	632	1106	76 77	FLAT FLAT	G Type	G G	501 502	593 593	1037 1037
14	SHOP	A-B Type	В	7	227	397	78	FLAT	G Type G Type	G	503	593	1037
15	SHOP	A-B Type	В	8	227	397	79	FLAT	H-I Type	н	102	656	1148
16	SHOP	A-B Type	В	9	227	397	80	FLAT	H-I Type	Н	103	656	1148
17	SHOP	A-B Type	В	10	227	397	81	FLAT	H-I Type	Н	104	665	1164
18	FLAT	A-B Type	В	103	632	1106	82	FLAT	H-I Type	Н	201	665	1164
19	FLAT	A-B Type	В	203	632	1106	83	FLAT	H-I Type	Н	203	656	1148
20	FLAT	A-B Type	В	204	635	1112	84	FLAT	H-I Type	H	301	665	1164
21	FLAT	A-B Type A-B Type	B B	303 401	632 673	1106 1178	85 86	FLAT FLAT	H-I Type H-I Type	H H	302 401	656 665	1148 1164
23	FLAT	A-B Type	В	401	670	1178	87	FLAT	H-I Type	Н	401	656	1148
24	FLAT	A-B Type	В	403	632	1106	88	FLAT	H-I Type	Н	403	656	1148
25	FLAT	A-B Type	В	404	635	1112	89	FLAT	H-I Type	Н	504	665	1164
26	FLAT	А-В Туре	В	504	635	1112	90	FLAT	H-I Type	I	101	665	1164
27	SHOP	C-D Type	С	13	227	397	91	FLAT	H-I Type	I	103	656	1148
28	FLAT	C-D Type	С	101	635	1112	92	FLAT	H-I Type	I	104	665	1164
29	FLAT	C-D Type	С	202	632	1106	93	FLAT FLAT	H-I Type H-I Type	I	201	665 656	1164 1148
30	FLAT	C-D Type	С	203	670	1172	95	FLAT	H-I Type	I	203	665	1164
31	FLAT	C-D Type	С	302	632	1106	96	FLAT	H-I Type	I	302	656	1148
32	FLAT SHOP	C-D Type	C	402 20	632 227	1106	97	FLAT	H-I Type	I	303	656	1148
34	SHOP	C-D Type C-D Type	D D	21	227	397 397	98	FLAT	H-I Type	I	304	665	1164
35	SHOP	C-D Type	D	23	227	397	99	FLAT	H-I Type	I	401	665	1164
36	FLAT	C-D Type	D	102	670	1172	100	FLAT FLAT	H-I Type	I	404 502	665 656	1164 1148
37	FLAT	C-D Type	D	103	632	1106	101	FLAT	H-I Type H-I Type	I	504	665	1164
38	FLAT	C-D Type	D	104	635	1112	103	FLAT	J Type	Ĵ	102	593	1037
39	FLAT	C-D Type	D	202	670	1172	104	FLAT	J Type	J	201	593	1037
40	FLAT	C-D Type	D	203	632	1106	105	FLAT	J Type	J	203	593	1037
41	FLAT	C-D Type	D	302	670	1172	106	FLAT	J Type	J	301	593	1037
42	FLAT	C-D Type	D	303	632	1106	107	FLAT	J Type	J	402	593	1037
43	FLAT	C-D Type	D	304	635	1112	108	FLAT	J Type	l l	403	593	1037
44	FLAT FLAT	C-D Type	D D	401 402	673 670	1178 1172	109 110	FLAT FLAT	J Type J Type	J	501 503	593 593	1037 1037
45	FLAT	C-D Type C-D Type	D	402	632	11/2	111	FLAT	J Type	J	504	593	1037
47	FLAT	C-D Type	D	403	635	1112	112	FLAT	K-L Type	K	102	632	1106
48	FLAT	C-D Type	D	503	632	1106	113	FLAT	K-L Type	K	103	632	1106
49	FLAT	C-D Type	D	504	635	1112	114	FLAT	K-L Type	K	104	635	1112
50	FLAT	E-F Type	Е	102	632	1106	115	FLAT	K-L Type	K	204	635	1112
51	FLAT	E-F Type	Е	104	635	1112	116 117	FLAT FLAT	K-L Type K-L Type	K K	402 502	632 632	1106 1106
52	FLAT	E-F Type	Е	201	635	1112	118	FLAT	K-L Type  K-L Type	K	502	635	1112
53	FLAT	E-F Type	Е	203	632	1106	119	FLAT	K-L Type  K-L Type	L	101	813	1423
54	FLAT	E-F Type	Е	301	635	1112	120	FLAT	K-L Type	L	202	632	1106
55	FLAT	E-F Type	E	401	635	1112	121	FLAT	K-L Type	L	204	635	1112
56		E-F Type	E	402	632	1106 1106	122		K-L Type	L	302	632	1106
57 58	FLAT FLAT	E-F Type E-F Type	E E	403	632 635	1112	123		K-L Type	L	402	632	1106
59	FLAT	E-F Type	E	501	635	1112	124 125		K-L Type	L L	403 501	632	1106
60	FLAT	E-F Type	E	502	632	1106		FLAT FLAT	K-L Type K-L Type	L	502	813 632	1423 1106
61	FLAT	E-F Type	E	503	632	1106	127		K-L Type  K-L Type	L	503	632	1106
62	FLAT	E-F Type	Е	504	635	1112	_	FLAT	K-L Type	L	504	635	1112
63	FLAT	E-F Type	F	104	410	717			Tota	1		76350	133612
						Annex							
			List of so	d units/Fla	ts Hypot	hecated w	ith PC	HFL in p	project "Rac	ihika Hor	nes"		

### List of sold units/Flats Hypothecated with PCHFL in project "Radhika Homes

Sr.No	Type of Unit	Block Type	Building	Flat/Shop	Floor	Carpet Area (Sq.fty	Saleable Area (Sq.ftj	Sales Value	Amt. Recd	Balance Amount
1	FLAT	A-B Type	Α	302	3rd Floor	632	1,106	11.1	11.1	-
2	FLAT	A-B Type	В	102	1st Floor	669.71	1,172	1 1.75	1.89	9.86
3	SHOP	C-D Type	С	14	Gr Floor	226.86	397	6.71	0	6.71
4	FLAT	C-D Type	С	502	5th Floor	632	1,106	11.1	3	8.1
5	FLAT	E-F Type	Е	101	1st Floor	635.43	1,112	11.15	1 .94	9.21
6	FLAT	E-F Type	Е	304	3rd Floor	635 43	1,112	14.46	2	12.46
7	FLAT	E-F Type	F	301	3rd Floor	409.71	717	7.2	0	7.2
8	FLAT	E-F Type	F	401	4th Floor	409.71	717	9.32	2	7.32
9	FLAT	K-L Type	L	201	2nd Floor	813.14	1,423	14.25	1.32	12.93

(Please Note that the units constructed in " Radhika Homes " for which PCHFL has issued NOCs for sale/lease, may be exclude rom the list mentioned hereinabove, on production of copies of the NOCs of PCHFL along with proofs in respect of payment mad o PCHFL (Earlier known as DHFL) and compliances of all other terms and conditions stipulated therein.)

Date: January 23, 2024

Sd/- (Authorised Officer)
PIRAMAL CAPITAL AND HOUSING FINANCE LTD.
(Formerly known as Dewan Housing Finance Corporation Ltd.)

Particulars	Quarter ending	Previous Quarter ending	months ended in the previous year	
	31-12-2023	30-09-2023	31-12-2022	31-12-2023
	Unaudited	Unaudited	Unaudited	Unaudited
Total income from operations	121.59	255.05	335.19	643.63
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or				
Extraordinary items)	26.84	30.96	14.38	89.18
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or				
Extraordinary items)	26.84	30.96	14.38	89.18
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or				
Extraordinary items)	19.84	24.08	14.38	75.30
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss)				
for the period (after tax) and other comprehensive income (after tax)]	19.84	24.08	14.38	75.30
Equity Share Capital	990.00	990.00	990.00	990.00
Earnings Per Share (before extraordinary items) (of Rs. 1/- each) (not annualised)				
Basic:	0.020	0.024	0.015	0.076
Diluted:	0.020	0.024	0.015	0.076
Earnings Per Share (after extraordinary items) (of Rs. 1/- each)				

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2023

			(	Rs. In Lakhs)	
Particulars	Quarter ending	Previous Quarter ending	Corresponding 3 months ended in the previous year	ear to date	
	31-12-2023	30-09-2023	31-12-2022	31-12-2023	
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	
Total income from operations	105.52	204.31	157.29	527.47	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or					
Extraordinary items)	24.03	27.82	30.21	82.09	
Profit after tay	23.05	22.01	30.21	75.30	

Notes:

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.ashnisha.in)

For, ASHNISHA INDUSTRIES LIMITED ASHOK C. SHAH MANAGING DIRECTOR DIN: 02467830



Date: 22-01-2024

Date: January 22, 2024

Place : Ahmedabad

Place: Ahmedabad

### RADHE DEVELOPERS (INDIA) LIMITED

Radhe Acres, Block No.-220,226 & 227, B/h. Applewoods Township, Shela, Ahmedabad - 380 058 CIN: L45201GJ1995PLC024491 | Phone: +91 79 26583381 www.radhedevelopers.com | secretarial@radheinfra.com

### NOTICE OF THE EXTRAORDINARY GENERAL MEETING

Notice is hereby given that the Extraordinary General Meeting (EGM) of the Members of the Radhe Developers (India) Limited will be held on **Wednesday, February 14, 2024** at 11:30 a.m. at the Registered Office of the Company to transact the businesses as set out in the Notice dated January 13, 2024 convening the EGM. The Notice of EGM and Attendance Slip have been sent to the members in the permitted mode. The above documents are also available on the Company's website www.radhedevelopers.com and Copies of Said Documents are also available for inspection at the registered office of the company on all working days, except Saturday and Sunday between 11.00 a.m. to 01.00 p.m prior to the date of Extraordinary General Meeting.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their vote electronically, through e-voting facility services provided by the National Securities Depository Limited (NSDL) on all resolutions se forth in the EGM notice. The voting rights shall be in proportion to the shares held by members as on Thursday, February 08, 2024 being the cut-off date. Any person who becomes member of the Company after dispatch of the Notice of the Meeting and holding shares as of the cut-off date may contact their respective depositories for availing eoting facility. Please note that a person whose name is recorded in the register of member or in the register of beneficial owners maintain by depositories as on cut-off date will only be entitled to avail the facility of remote e-voting or voting at the EGM venue. The Notice of Extraordinary General Meeting is also available at the National Securities Depository Limited (NSDL) Website.

The remote e-voting period will commences on Sunday, February 11, 2024 (9:00 a.m.) and ends on Tuesday, February 13, 2024 (5:00 p.m.). During this period, members, holding shares either in physical form or in dematerialisation form, as on the cut-off date i.e. Thursday, February 08, 2024 can cast their vote electronically in the manner and process set out in the EGM Notice. The remote e-voting shall not be allowed beyond the aforesaid date and time and the facility shall forthwith be blocked. Once the vote on a resolution is cast by the member, the member will not be allowed to change t subsequently. A member can participate in the EGM even after exercising the right to vote through remote e-voting but will not be allowed to vote again at the EGM. Members not obtained for remote e-voting will be offered the facility to vote at the venue of the EGM, A member can opt for only one mode of voting that is either through remote e-voting or at the EGM venue. The result of e-Voting/Voting at EGM shall be declared on or before Friday. February 16, 2024 The results declared and the scrutinizer's Report shall be made available at the Registered Office of the Company and on the Company's website and shall also be communicated to the Stock Exchanges where the Company's shares are listed. The Company has appointed Mr. Alkesh Jalan, Practising Company Secretary as the Scrutinizer to scrutinize the e voting process in fair and transparent manner.

In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evoting.nsdl.com, under help section or write an email to evoting@nsdl.co.in Call on 1800-1020-990/1800-2244-30 or at the mcsahmed@gmail.com/mcsstaahmd@gmail.com or call on 079-26580461/

Please keep your updated email ID Registered with the Company/Your Depository Participant to receive timely

The details of the EGM are available on the website of the Company at www.radhedevelopers.com and on the website of stock exchange at www.bseindia.com. By Order of the Board of Directors

For, Radhe Developers (India) Limited

Khyati K. Patel Company Secretary & Compliance Officer

## 3

# કોચિંગ ક્લાસ પર લગામ કસાઈ, ૧૦ પોઈન્ટમાં સમજો નવી ગાઈડલાઈન

વધતા આત્મહત્યાના કેસ, દુર્ઘટનાઓ વગેરેના પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક નવી ગાઈડલાઈન તૈયાર કરી છે. જેને માનવી તમામ કોચિંગ સંસ્થાઓ માટે જરૂરી છે. તેનો અને નોટ્સ પણ વિદ્યાર્થીઓને પૈસા ભંગ કરનારા કોચિંગ સેન્ટરો પર એક લાખ રૂપિયાથી લઈને રજિસ્ટ્રેશન રદ કરવા જેવી કાર્યવાહી પણ થઈ શકે છે. ૧૦ પોઈન્ટમાં સમજો આ સમગ્ર ગાઈડલાઈન…

૧. ઉંમર મર્યાદા નક્કી

શિક્ષણ મંત્રાલયે કોચિંગ સંસ્થાનોને લઈને જે ગાઈડલાઈન કેમેરા લાગવવાના રહેશે. બહાર પાડી છે તેમાં ઉંમર મર્યાદા નક્કી કરી લીધી છે. હવે ૧૬ વર્ષ કે જગ્યા જરૂરી તેનાથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના પ્રવેશ પર નો એન્ટ્રી લાગી ગઈ છે. એટલે કે તેનો સીધો અર્થ એ થાય છે કે કોચિંગમાં પ્રવેશ સેકન્ડરી (૧૦ ધોરણ)ની પરીક્ષા બાદ જ થઈ શકશે. આ નિયમનો ભંગ કરનારા સંસ્થાનો પર કાર્યવાહી થશે.

૨. ફ્રીની રસીદ આપવી પડશે નવી ગાઈડલાઈન મુજબ કોચિંગ સેન્ટરોએ વિદ્યાર્થીઓને ફીની રસીદ આપવી પડશે. આ સાથે જ વિવિધ કોર્સનો ઉલ્લેખ ક રતા એક પ્રોસ્પેક્ટ્સ પણ બહાર પાડવા પડશે. જેમાં ફી અને જમા કરવાના નિયમની પણ જાણકારી આપવી પડશે. કોચિંગ એક સમિતિ હશે. સંબંધિત તમામ જરૂરી જાણકારીઓ વેબસાઈટ પર આપવી પડશે. : નવી ગાઈડલાઈન મુજબ શાળાના રજિસ્ટ્રેશન બાદ જ કોચિંગ શરૂ થઈ ક્લાસિસ સમયે વિદ્યાર્થીઓ કોચિંગ શકશે. અત્યારના કોચિંગ ક્લાસને ક્લાસ નહી કરી શકે. કોચિંગ ક્લાસે

હોય તો અલગ યુનિટ ગણાશે.

૩. અધવચ્ચે કોચિંગ છોડે તો ફ્રી પાછી આપવી પડે

કોચિંગ સંસ્થાનોએ પ્રોસ્પેક્ટ્સ વગર આપવા પડશે. જો વિદ્યાર્થીએ પાઠયક્રમ માટે પરી ફ્રી જમા કરી દીધી હોય પરંતુ અધવચ્ચે જ કોચિંગ છોડે તો વધેલી ફ્રી ૧૦ દિવસમાં પાછી આપવી પડશે. કોઈ એક કોર્સની ફ્રી લીધા બાદ વધારી શકાશે નહીં. કોચિંગમાં જરૂરી હોય ત્યાં સીસીટીવી

૪. ઓછામાં ઓછી ૧ મીટરની

કોચિંગ ક્લાસમાં દરેક વિદ્યાર્થી માટે ઓછામાં ઓછી એક વર્ગ મીટરની જગ્યા હોવી જોઈએ. આ ઉપરાંત ફર્સ્ટ એડ કિટ અને મેડિકલ આસિસ્ટન્સ ફેસિલિટી પણ જરૂરી છે. પીવાનું સ્વચ્છ પાણી અને સીસીટીવી કેમેરા પણ હોવા જોઈએ. વિદ્યાર્થીઓ માટે જરૂરી જગ્યા અને સંસાધન નહીં હોય તો રજિસ્ટ્રેશન નહીં થાય.

૫. ફરિયાદ નિવારણ માટે સમિતિ : ગાઈડલાઈન મુજબ કોચિંગ સેન્ટરમાં એક ફરિયાદ નિવારણ પેટી કે રજિસ્ટર રાખી શકાય છે. કોચિંગ

૬. શાળાના સમયે કોચિંગ નહી

કારોબારના કારણે વિદ્યાર્થીઓના રહેશે. કોઈ ક્લાસની અનેક શાખા દિવસની સાપ્તાહિક રજા પણ સનિશ્ચિત કરવી પડશે.

> ૭. રજાના આગલા દિવસે કોઈ ટેસ્ટ નહી લે

હવે સાપ્તાહિક રજાના આગલા દિવસે કોઈ ટેસ્ટ નહીં લેવાય. કોચિંગ ક્લાસ એક દિવસમાં પાંચ કલાકથી વધુ નહીં હોય. આ સાથે જ બહુ વહેલી સવારે કે મોડી સાંજે પણ નહીં થઈ શકે. મોટા તહેવારો વખતે બાળકો પરિવાર સાથે રહી શકે તે રીતે રજા આપવી પડશે.

૮. કોચિંગ સંસ્થાન આયોજિત કરે કાઉન્સિલિંગ સેશન

કોચિંગ સંસ્થાનોએ લાઈફ સ્કિલ, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, રચનાત્મકતા અને ફિટનેસ, વેલનેસ, ઈમોશનલ બોન્ડિંગ, મેન્ટલ વેલ બિઈંગ, મોટિવેશન માટે ટીચર, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલિંગ સેશન આયોજિત કરવા પડશે. ૯. ટેસ્ટ રિઝલ્ટ જાહેર નહીં

નવી ગાઈડલાઈન મુજબ કોચિંગ સેન્ટર પોતાના દ્વારા આયોજિત ટેસ્ટના પરિણામને જાહેર કરી શકશે નહીં. તેનો ઉપયોગ ફક્ત વિદ્યાર્થીઓના દેખાવના નિયમિત કુવૈતી દિનાર છે. એક કુવૈતી દિનાર વિશ્લેષણ માટે જ થવો જોઈએ.

સેન્ટરમાં ફરિયાદોના નિવારણ માટે કોચિંગ સંસ્થાનો કોઈ પણ વિદ્યાર્થી સાથે જાતિ, ધર્મ, નસ્લ, લિંગ, જન્મસ્થાન, વંશ વગેરેના આધાર પર ભેદભાવ કરશે નહીં. કોચિંગ ઓમાની રિયાલનું છે. આ કરન્સી સેન્ટરની ઈમારત અને આજુબાજુનું પરિસર દિવ્યાંગો માટે અનુકૂળ હશે. ડોલરની બરાબર છે. આ પછી ચોથા

## પશ્ચિમ રેલવે દારા ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા

અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા વધારી દેવામાં આવી છે.

ર. ટ્રેન નંબર ૦૯૪૫૬ ભુજ-યાત્રીઓની સૂવિધા તથા તેમની સાબરમતી સ્પેશિયલ જેને પહેલાં ૨૨ માંગને પૂરી કરવાના ઉદ્દેશથી ભુજ- જાન્યુઆરી, ૨૦૨૪ સુધી જાહેર સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ફેરા કરવામાં આવી હતી, તેને હવે ૨૫ વિશેષ ભાડા પર વધારવાનો નિર્ણય જાન્યુઆરી, ૨૦૨૪ સુધી વધારી લેવામાં આવ્યો છે. જેની વિગતો આ દેવામાં આવી છે. ટ્રેન નંબર પ્રકારે છેઃ ૧. ટ્રેન નંબર ૦૯૪૫૫ ૦૯૪૫૫ અને ૦૯૪૫૬ ના સાબરમતી-ભુજ સ્પેશિયલ જેને વધારેલા ફેરાનું બુકિંગ ૨૨ પહેલાં ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ તમામ જાહેર કરવામાં આવી હતી, તેને હવે પીઆરએસ કાઉન્ટરો અને ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી આઈઆરસીટીસી વેબસાઈટ પર

## વિશ્વની મજબૂત કરન્સીમાં ભારત ૧૫મા ક્રમે, દિનાર પ્રથમ ક્રમાં કે

લોકપ્રિય કરન્સી હોવા છતાં, ડોલર કરન્સી રૂપિયા ૧૧૭.૧૦ અને મજબત કરન્સી નથી. તેમજ મજબૂત ૧.૧૪૧ ડોલરની બરાબર છે. કરન્સીના સંદર્ભમાં ભારતની કરન્સી પાંચમા સ્થાને જિબ્રાલ્ટર પાઉન્ડ છે વિશ્વની ટોપ ૧૦ કરન્સી રેન્કિંગમાંથી બહાર છે. તાજેતરમાં ફોર્બ્સે મજબૂત ડોલરની બરાબર છે. બ્રિટિશ કરન્સીનું રેક્કિંગ જાહેર કર્યું છે. આ રેન્કિંગમાં મજબૂત કરન્સીના સંદર્ભમાં ડોલરને ૧૦માં સ્થાને રાખવામાં આવ્યું છે. જો આ લિસ્ટમાં આપણે ભારતીય કરન્સી રૂપિયા વિશે વાત કરીએ તો તે ૧૫મા સ્થાને છે.

ફોર્બ્સની યાદીમાં પ્રથમ સ્થાને રૂપિયા ૨૭૦.૨૩ અને ૩ ડોલ૨ ૧૦. દિવ્યાંગો મુજબ પરિસર : બરાબર છે. તેમજ એક બહેરીની દિનાર રૂપિયા ૨૨૦.૪ અને ૨.૬૫ ડોલરની બરાબર છે. આ કરન્સી બીજા સ્થાને છે. યાદીમાં ત્રીજું સ્થાન રૂપિયા ૨૧૫.૮૪ અને ૨.૬૦

નવી દિલ્હી, વિશ્વમાં સૌથી વધુ સ્થાને જોર્ડનની કરન્સી દીનાર છે. આ જે રૂપિયા ૧૦૫.૫૨ અને ૧.૨૭ પાઉન્ડની રેક્રિંગ છક્રી છે, તે પણ રૂપિયા ૧૦૫.૫૪ અને ૧.૨૭ ડોલરની બરાબર છે. સાતમા, આઠમા અને નવમા સ્થાને અનુક્રમે કેમેન આઇલેન્ડ્સ ડોલર, સ્વિસ ફ્રેંક અને યુરો છે. આ પછી અમેરિકન ડોલર ૧૦મા સ્થાને આવે છે. હાલમાં યુએસ ડોલર રૂપિયા ૮૩.૧૦ પર ટ્રેડ થઈ રહ્યો છે.

લાલ સમુદ્રમાં તણાવ વધી રહ્યો છે.

યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું

ટેક્રર પર બે એન્ટિ-શિપ બેલેસ્ટિક

મિસાઇલો છોડી હતી. જોકે આ

મિસાઈલો જહાજની નજીકના

પાણીમાં પડી હતી, પરંતુ કોઈ ઈજા

# જનરલ મેનેજર પશ્ચિમ રેલવે દ્વારા ધ્રાંગધ્રા-અમદાવાદ સેક્શનનું સંરક્ષા નિરીક્ષણ

અમદાવાદ, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર એ ૧૯ જાન્યઆરી. ૨૦૨૪ ના રોજ અમદાવાદ મંડળના ધ્રાંગધ્રા-અમદાવાદ સેક્શનનું સરંક્ષા નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન શ્રી મિશ્ર એ સુરક્ષા અને સંરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ કામ, સ્ટેશન પર યાત્રી સુવિધાઓ તથા અન્ય વિકાસ કામનું અવલોકન કર્યું તથા ધ્રાંગધા-અમદાવાદ વચ્ચે રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ, મહત્વપૂર્ણ અને નાના-મોટા પુલો, પોઈન્ટ્સ, સેક્શનમાં કર્વ્સ, ક્રોસિંગ અને સુરક્ષા ધોરણો મુજબ સેકશનનું ગહન નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમિયાન મુખ્ય મેનેજરની સાથે પ્રમુખ વિભાગાધ્યક્ષ, મંડળ રેલવે મેનેજર અમદાવાદ શ્રી સુધીર કુમાર શર્મા, મંડળના શાખા અધિકારી અને અમદાવાદ મંડળના અન્ય સિનિયર અધિકારી પણ ઉપસ્થિત હતા. આ દરમિયાન મંડળના ધ્રાંગધ્રા, વસાડવા, વિરમગામ અને આમલી રોડ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. ધ્રાંગધ્રા સ્ટેશન પર જનરલ મેનેજરે રનિંગ રૂમમાં કિચન, મેસ, રનિંગ રૂમ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્ટેશન પર ARME સ્કેલ II નું નિરીક્ષણ કર્યું અને ધ્રાંગધ્રા સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્લાનનું અવલોકન કર્યું.



હરિપર અને વસાડવા સ્ટેશનો વચ્ચે મેજર બ્રિજ નંબર ૬૦ કિમી ૬૧૨/ ૯-૭ અને ગેન્ગ નંબર ૬ નું નિરીક્ષણ કર્યું. વસાડવા સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ પોઈન્ટ અને ક્રોસિંગ નંબર ૧૨૦ નું નિરીક્ષણ કર્યું. લેવલ ક્રોસિંગ નંબર ૧૫ કિમી પ૭૯/૯-૧૧, લેવલ ક્રોસિંગ નંબર ૧૪ ના રોડ અન્ડર બ્રિજ (RUમ) નંબર૧૬છ અને બ્રિજ નં. ૫૩ નું નિરીક્ષણ કર્યું.

રિડેવલપમેન્ટ પ્લાન, રેલવે કોલોની, કોમ્યુનિટી હોલ, આરપીએફ બેરેક એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે અને હેલ્થ યુનિટનું નિરીક્ષણ કર્યું. વાર્તાલાપ પણ કર્યો.

જખવાડા અને આમલી રોડ સ્ટેશન વચ્ચે ૧૨૦ કિમી દર કલાકની ગતિનું પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આમલી રોડ સ્ટેશન પર વિવિધ યાત્રી સુવિધાઓ, રેલવે કોલોની અને ચિલ્ડન પાર્કનું નિરીક્ષણ કર્યું તથા આમલી રોડ કોલોનીના ચિલ્ડ્રન પાર્કમાં રેલવે કર્મચારીઓના પરિવારના સભ્યો પાસે વૃક્ષારોપણ કરાવ્યું. જનરલ મેનેજર શ્રી મિશ્ર એ પોતાના નિરીક્ષણ વિરમગામ સ્ટેશન પર દરમિયાન વિવિધ સ્થળોએ જનપ્રતિનિધિઓ, યુનિયનો,

### આશિષ પોલિપ્લાસ્ટ લિમિટેડ

સીઆઇએનઃ L17110GJ1994PLC021391 રજિસ્ટર્ડ ઓફિસ : ૫૦૧, ફૉર્ચ્યુન બિઝનેસ હબ, સત્યમેવ એલિસીયમ પાસે, સાઇંસ સિટી પાસે , સોલા અમદાવાદ-૩૮૦૦૬૦, ફોન (ઓ.) ૯૦૯૯૦૫૨૫૮૨, ૯૮૨૫૨૨૦૯૭૭ ઇમેઇલ: ashishpolyplast@gmail.com, વેબસાઇટ:www.ashishpolyplast.com

### જાહેર સૂચના

અહી(સેબીના નિયમન ૨૯(૧) (લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ)

રેગ્યુલેશન ૨૦૧૫ને અનુસરીને નોંધ લો કે ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામો ને ધ્યાનમાં લેવા અને (૨) આશિષ ડી પંચાલ, મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવાપાત્ર મહેનતાણું પર સંશોધન કરવા માટે કંપનીના રજિસ્ટર્ડ ઑફિસમાં મંગળવારે ૩૦મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સાંજે ૦૫.૦૦ વાગ્યે યોજાવાની છે.

આશિષ પોલિપ્લાસ્ટ લિમિટેડ વર્ત

આશિષ ડી પંચાલ

તારીખઃ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪. સ્થળઃ અમદાવાદ

(વહીવટી સંચાલક ડીઆઇએનઃ ૦૦૫૯૮૨૦૯

### પશ્ચિમ રેલવે – વડોદરા ડિવિઝન <u>'ક્લોક રૂમના ઓપરેશન અને મેનેજમેન્ટ' કોન્ટ્રાક્ટ ના કોન્ટ્રાક્ટ્સ માટે ઈ–હરાજી</u> પત્ર નં. Comm/BRC/E-Auction/23 સંદર્ભ : RB's પત્ર નં. 2022/TC(FM)/10/04 dtd : 13-06-2022

. ઉપરોક્ત સંદર્ભમાં, વડોદરા રેલવે સ્ટેશન ખાતે 'ક્લોક રૂમના ઓપરેશન અને સંચાલન' કોન્ટ્રાક્ટના કોન્ટ્રાક્ટ્સ માટે તા.01-02-2024 ના રોજ ઈ-હરાજીનું આયોજન કરવામાં આવશે. ઈ-હરાજી તા.01-02-2024 ના રોજ 11:00 કલાકે શરૂ થશે. કેટલોગ પહેલે થી www.ireps.gov.in વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલ છે

કેટલોગ નં.	કોન્ટ્રાક્ટ નો પ્રકાર	લોટ નં.	કોન્ટ્રાક્ટનો સમયગાળો			
BRC-Cloak Room-2	વડોદરા રેલવે સ્ટેશન ખાતે ક્લોક રૂમનું ઓપરેશન અને મેનેજમેન્ટ	PnU-BRC-BRC-WRL-14-24-1 (પે એન્ડ યુઝ – લોન્જીસ / વેઈટીંગ / રિટાઈરીંગ / ક્લોક રૂમ)	05 વર્ષ BRC-306			
wild cuts sale of feesbook com Mostorn Ply - 2002 Sele Military com Mostorn Ply						

### શ્રીરામ હાઉસિંગ ફાયાનાન્સ લીમીટેડ

SHRIRAM

હેડ ઓફિસ : લેવલ ૧, વૉક હાર્ટ ટોવર, ઈસ્ટ વિન્ગ, સી-૨, જી બ્લોક, બાંન્દ્રા કુર્લા કોમ્પ્લેક્ષ, બાંદ્રા (ઈસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૫૧ વેબસાઇટ : www.shriramhousing.in

ભૌતિક કબ્જા નોટીસ

આથી અહીં જણાવવાનું કે નીચે સહી કરનાર શ્રીરામ હાઉસિંગ ફાયનાન્સ લિમીટેડ (એસએચએફએલ)ના અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન અને રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (જણાવેલ કાયદા) નિયમો, ૨૦૦૨ (જણાવેલ નિયમો)ના નિયમ ૩ સાથે વંચાતી કલમ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તાની રૂએ નીચે કોષ્ટકમાં જણાવેલ કરજદારોને જ્ણાવેલ માંગણા નોટીસોમાં જ્ણાવેલ ૨કમ પરત ચુકવવા માંગણા નોટીસો જારી કરી

કરજદારો રકમની પુનઃચુકવણી કરવામાં નિષ્ફળ ગયા છે.પરિણામે કરજદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અહી નીચે સહી કરનાર અધિકત અધિકારીએ એડીશનલ ચીફ મેટોપોલિટન મજિસ્ટેટ. અમદાવાદમાં ક્રિમીનલ મીસ્ક એપ્લીકેશન નં. ૧૨૪૩૦/૨૦૨૩ હુક્મ તારીખ ૦૬/૧૨/૨૦૨૩ના રોજ સરફેસી એક્ટ ૨૦૦૨ના સેક્શન ૧૪ મુજબ અનુસરતા અને સિક્યોરીટાઇઝેશન એન્ડ રિકન્સટ્રક્શન ફાયનેન્શીયલ એસેટ્સ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એન્ફ્રોર્સમેન્ટ નિયમ, ૨૦૦૨ના નિયમ ૧૩(૪) વંચાશે લેતા મળેલી સત્તાની રૂએ ૨૧.૦૧.૨૦૨૪ના રોજ કાર્યવાહી કરી નીચે વર્શન કરવામાં આવેલ તેના/તેણી નામે રહેલ મિલ્કતનો ભૌતિક કબ્જો મેળવી લીધો છે.

કરજદાર અને ખાસ કરી જાહેર જનતાને મિલકત સાથે કોઈ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઈપણ સોદો શ્રી રામ હાઉસિંગ ફાયનાન્સ લી.ની નીચે જણાવેલ ૨કમ તેમજ તેના પર વ્યાજના ચાર્જને આધિન રહેશે.

કરજદારો ધ્યાન આપે કે આ કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૮) મુજબ આ ગીરો મિલકત મુકત કરાવવાનો સમય મળે છે.

### કરજદારનું નામ અને

૧. ગુલાબચંદ બાબુલાલ વર્મા, ર. ફૂલચંદભાઈ બાબુલાલ પટેલ, હાલનું સરનામું નં. ૧ અને ૨ઃ- ૧૪૯, રામ રાજ્યનગર, વસ્ત્રાલ, અમરાઈવાડી. અમદાવાદ- ૩૮૦૦૨૬.

અન્ય મિલ્કત સરનામું નં. ૧ અને ૨ઃ- ફ્લેટ નં. સી-૧/૫૦૪, પમો માળ, રત્નરૂચિ વાટિકા, મૌજેઃ પાલડી, તાલુકાઃ સાબરમતી, અમદાવાદ-320009

બિઝનેસ સરનામું નં. ૧ઃ-એચ- ૨૦૪, સુમેલ બિઝનેસ, પાર્ક-૭,એન.એચ રોડ-૮, સોનીની ચૉલ પાસે , રખિયાલ, અમદાવાદ- ૩૮૦૦૨૩.

રૂા. ૪૧,૪૯,૭૭૬/- (રૂપિયા ઇકતાલીસ લાખ ઓગણપચાસ હજાર સાત સો છોતેર પુરા) જે ૦૮/૦૮/૨૦૨૩ ના રેક્રેન્સ ઓફ લોન એકાઉન્ટ નં. SHLHAHMD0001100 અને રા. ૧.૨૮.૯૪૪/- ( રૂપિયા એક લાખ અઠાવીસ .જાર નવ સો ચુવાલીસ પુરા) જે ૦૮/૦૮/૨૦૨૩ ના રેફ્રેન્સ ઓફ લોન એકાઉન્ટ નં.

માંગણા નોટિસ મુજબ બાકી રકમ

SLPHAHMD0001101 અને ઉપરોક્ત નિર્ધારિત વ્યાજ દર,સાથે <sub></sub> જુણાવેલ નોટીસ પ્રસિઘ્ધ અને પ્રાપ્ત થયાના ૬૦ દિવસની અંદર ચુકવી દેવી.

> ૧૩(૨) નોટિસ તારીખઃ 06/06/2023.

મિલકતનું વર્ણન

ામામ ભાગ અને હિસ્સો ઓફ સ્થાવર મિલ્કત બિઇંગ ફ્લેટ નં. સી-૧/૫૦૪, પમો માળ,જેનો માપ એરિયા ૧૨૨ સ્કેવર યાર્ડ્સ જેમકે ૧૦૨.૧૧ સ્કેવર મી. ( સુપર બિલ્ટ-અપ), જેમ કે ૬૯.૫૬ સ્કેવર યાર્ડ્સ જેમકે ૫૮.૧૬ સ્કેવર મી.( કારપેટ) અલગથી અનિડવાઇડેડ શેરલેન્ડ જેનો માપ એરિય ૨૮.૨૭ સ્ક્રેવર મી. સ્ક્રીમ રત્નરૂચિ વાટિકા તરીકે ઓળખાય છે, જેનો બાંધકામ લેન્ડ બેરિંગ સર્વે નં ૩૬/એ/૧ અને ૩૬/એ/૨/૨ બિઇંગ ફાયનલ પ્લાટનં. ૩૬/એ/૧ અને ૩૬/એ/૨/૨ માપ ૪૩૮૨ સ્કેવર મી ઓફ ટૉઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨૨ ઓફ મૌજે : પાલડી, તાલુકા : સાબરમતી જે ડિસ્ટ્રીક્ટ ઓફ અમદાવાદ અને રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૪ (પાલડી), ગુજરાત રાજ્યમાં સ્થિત છે. મિલકતની ચારે બાજુ: પુર્વે :- સોસાયટી કૉમન રોડ, પશ્ચિમે :- ફ્લેટ નં. સી-૧/૫૦૩, બી ઉત્તરે

અલેટ નં. સી-૨/૫૦૧, દક્ષિણે : કૉમન સ્ટેઅ૨. સ્થળ :અમદાવાદ સહી/- અધિકૃત અધિકારી શ્રી રામ હાઉસિંગ ફાયના<sup>ન્</sup>સ લીમીટેડ

## નવસારીમાં લુંટ અને ફાયરિંગના ગુનામાં ૧૯૯૯થી ફરાર આરોપી આખરે ઝડપાયો

પોલીસ સ્ટેશનમાં લુંટ તથા નાસ્તા ફરતા મોતીલાલ જાદવની ફાયરિંગના ગુનામાં પકડાયેલો આરોપી મોતીલાલ હરીસિંહ ઉર્ફે પોલીસને સોંપવામાં આવ્યો છે. હંસરાજ જાદવ નવસારી સિવિલ જ્યાંથી મહારાષ્ટ્રમાં નોંધાયેલા લૂંટ હોસ્પિટલ માંથી વર્ષ ૧૯૯૯માં ફરાર વિથ ફાયરિંગના ગુનામાં પણ તેની થઈ ગયો હતો. મોતીલાલ હરીસિંગ ધરપકડ માટે મહારાષ્ટ્ર પોલીસને જાણ જાદવ કે જે મૂળ મહારાષ્ટ્રના ધુલિયા કરવામાં આવી છે. જે રીતે જિલ્લાનો રહેવાસી છે જેના વિરુદ્ધમાં ગુજરાતમાં વોન્ટેડ ફરાર આરોપી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ બ્રાન્ચ હાથે ઝડપાઈ ચક્ચો છે

અમદાવાદ. નવસારી ગ્રામ્ય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૨૬ વર્ષથી ધરપકડ કરી અને તેને નવસારી ટાઉન પોલીસે તેની ધરપકડ કરી છે. જાદવ હવે ડોક્ટર અજય પટેલ બની

બીજો પણ ગુનો નોંધાયો હતો. જોકે . જેને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ફરાર આરોપીને શોધવા પણ છેલ્લા ૧૫ દિવસથી હરસુદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા છ ગામમાં અલગ અલગ વેશપલટો મહિનાથી અલગ અલગ જગ્યા ઉપર કરીને વોચ રાખવામાં આવી હતી. તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ ૨૦ વર્ષ પહેલાંનો મોતીલાલ હવે બ્રાન્ચની ટીમે છ મહિનાથી આરોપી ડૉ.અજય પટેલ બની જતા તેને મોતીલાલ અને તેના સગા સંબંધીઓ પકડવો પણ પોલીસ માટે એક પડકાર વિશે ખાનગી માહિતીઓ અને સાબિત થયો હતો. ફરાર આરોપી મોબાઈલ નંબરો મેળવી તપાસ કરી મોતીલાલની તપાસ દરમિયાન સામે રહી હતી. જે દરમિયાન આરોપી આવ્યું કે મોતીલાલ છેલ્લા ૨૦ વર્ષથી મોતીલાલ હરિસિંહ છેલ્લા ૨૦ વર્ષથી મધ્યપ્રદેશના હરસદ ખાતે પોતાનું મધ્યપ્રદેશના હરસુદમાં પોતાનું નામ નામ ડોક્ટર અજય પટેલ ધારણ કરી બદલી રહેતો હોવાનું સામે આવતા અને રહેતો હતો. એટલે કે મોતીલાલ

## એનક્વાલા ઓપ્ટીકલ્સ દ્વારા વિઝન ૨૦૨૪ માટે પ કિમી વોકનું આયોજન



અમદાવાદ : છેલ્લા ૫ વર્ષથી ક્ષેત્ર તરીકે વિચારવા અને સ્માર્ટ એનક્વાલા ઓપ્ટીકલ્સ જે સમગ્ર રોકાણો દ્વારા આ ક્ષેત્રમાંથી નિષ્ક્રિય અમદાવાદમાં ૧૬ થી વધુ ઓપ્ટિકલ સ્ટોર્સની સાંકળ છે, તેના લાખો આદરણીય ગ્રાહકોને સંગઠિત રીતે સ્પેક્ટેકલ્સ, આંખના ચશ્મા અને અને સાથે સાથે એક ઝજીઇ વિઝન ગુણવત્તાયુક્ત દ્રષ્ટિની ગુણવત્તા પ્રદાન તરીકે સમાજને પાછું આપવા અને આ કરે છે. વોક ફોર વિઝન ૨૦૨૪ ની રન થી એક ટોકન રકમને બધ્ધા સાથે કલ્પના એનક્વાલા ઓપ્ટિકલ મળીને લાયન્સ આઇ હોસ્પિટલને સ્ટોર્સના સ્વપ્રદ્રષ્ટા સ્થાપકો - શ્રી દાન કરવી. પ કિમીની આ વિઝન રાહુલ અને શ્રીમતી રચના ટાટેડ દ્વારા ૨૦૨૪ વો કમાં એનક્વાલા ૩ પાંખીય વ્યૂહરચના તરીકે કરવામાં ઓપ્ટીકલ્સના આદરણીય શેરધારકો, આવી છે. સૌપ્રથમ તેના પ્રતિષ્ઠિત રોકાણકારો, ગ્રાહકો, ટીમના સભ્યો, ગ્રાહકો અને રોકાણકારોને વર્ષ કુટુંબીજનો, લાયન્સ ક્લબના સભ્યો ૨૦૨૪ માં વિઝનનું સ્વપ્ન જોવા માટે અને પ્રતિષ્ઠિત મહેમાનો એ ભાગ પ્રોત્સાહિત કરવા અને જેથી તે યોગ્યતા અને સ્વસ્થ જીવનશૈલી સાથે વ્યાપક દ્રષ્ટિ અને જુસ્સા સાથે વધુ એમના હાંસલ ટાર્ગેટ્સને હાંસલ કરે સારા સ્વસ્થ અને ફિટ વિશ્વના હેતુ એના માટે પ્રાર્થના કરવા, બીજું માટે સાથે ચાલ્યા અને સમુદાયને

નાણાકીય આવક મેળવવા માટે આત્મનિર્ભર ઉદ્યોગસાહસિકતાનું સર્જન કરવા લીધા હતા. બધ્ધા એ આગળ જોવાની

ઓપ્ટિકલ બિઝનેસને એક સંગઠિત મદદ કર્યાં. (૧૯-૮) Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLIATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLIATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali rly crossing, mithakhali, ahmedabad. Editior: Mayur C. ધરાવતો હતો અને તેણે લગ્ન પણ પણ બની ચૂક્યો હતો.

ચુક્યો હતો. હરસુદમાં ડોક્ટર અજય કરી લીધા હતા. ડોક્ટર અજય અજય પટેલ પોતાની ખૂબ સારી છાપ પટેલ હરસુદમાં બજરંગ દળનો પ્રમુખ

રશિયા ભારતના મોટા ક્રૂડ ઓઈલ સપ્લાયર તરીકે ઊભરી આવ્યું નવી દિલ્હી, ભારત માટે ઈરાક ખરીદીને પગલે ગલ્ફ દેશોને સૌથી

તરીકે ઉભરી આવ્યું છે.

બદલાતા સમય અને પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું શરુ કરતા ગલ્ફના દેશો સપ્લાયરના લિસ્ટમાં નીચેના ક્રમે આવી ગયા છે. ભારતે વર્ષ ૨૦૨૩માં રશિયા પાસેથી સૌથી વધુ તેલની ખરીદી કરી હતી. માહિતી અનુસાર, ભારતે ગયા વર્ષે રશિયા પાસેથી પ્રતિ દિવસ ૧૬.૬ લાખ બેરલ તેલની આયાત કરી હતી. ૨૦૨૨માં આ આંકડો માત્ર ૬.૫૧ લાખ બેરલ પ્રતિ દિવસ હતો. આનો અર્થ એ થયો કે ૨૦૨૨ની તુલનામાં ૨૦૨૩માં ભારત દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદીમાં ૧૫૫ ટકાનો જબરદસ્ત વધારો થયો છે. એક સમચાર એજન્સીના જણાવ્યા અનુસાર ભારતની ૨૦૨૩માં રશિયા પાસેથી તેલની વધતી

પશ્ચિમ રેલવે

<u>બગડેલા બ્રિજ મેમ્બર્સનું સમારકામ</u> <u>અને બદલીકરણ</u> ઈ-ટેન્ડર નોટીસ નં. DYCE-BR-BRC-01-2024

ભારતના રાષ્ટ્રપતિ માટે અને વતી ડેપ્યુટી ચીફ એન્જીનીયર (બ્રીજ લાઈન) વડોદરા, પશ્ચિમ રેલવે પ્રતાપનગર, વડોદરા-390 004 દ્વારા નીચે જણાવેલ કામ માટે ઈ-ટેન્ડરો આમંત્રિત કરવામાં આવે છે. **ટેન્ડર** નં. DYCE- BR-BRC-01-2024. કામનું નામઃ ત્રાહિત પક્ષના ઓડિટ અહેવાલની ભલામણ મુજબ વડોદરા મંડળના અંકલેશ્વર અને ભરૂચ સ્ટેશનો વચ્ચે બ્રિ નં. 502 (નર્મદા નદી) ના પુનવસિના સંબંધમાં બગડેલા બ્રિજ મેમ્બર્સનું સમારકામ અને બદલીકરણ કરવાનું કામ. કાર્યની અંદાજીત પડતરઃ ₹ 46,92,71,474.11 જમા કરાવવાની બીડ સિક્યરીટી ₹ 24,96,400.00, ઈ-ટેન્ડર જમા કરાવવાની **અને ઈ-ટેન્ડર ખુલવાની તારીખ અને સમયઃ** ઓન લાઈન ટેન્ડર <u>તા.23-02-2024</u> ના રોજ 15:00 કલાક પહેલા જમા કરાવવાનું રહેશે અને તે જ તારીખે 15:30 કલાકે ખોલવામાં આવશે. **વેબસાઈટ વિગત** અને નોટીસ માટે સ્થળ જ્યાં સંપૂર્ણ વિગતો જોઈ **શકાશે વગેરે :** ડેપ્યુટી ચીફ એન્જીનીયર (બ્રિજ લાઈન) વડોદરા, પશ્ચિમ રેલવે, પ્રતાપનગર, વડોદરા-4 વેબસાઈટ @ www.ireps.gov.in

Date: 22-01-2024

અને સાઉદી અરેબિયા લાંબા સમયથી 🛮 વધુ નુકસાન થયું છે અને ભારતની સૌથી મોટા તેલ (ક્રૂડ ઓઈલ)ના ગલ્ફ દેશોમાંથી તેલની ખરીદી સપ્લાયર રહ્યા છે, જો કે ગયા વર્ષના 🛮 અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચી આંકડાની વાત કરવામાં આવે તો ગઈ છે. આ કારણે ઇરાક અને સાઉદી સ્થિતિ કઈક અલગ જ જોવા મળે છે. અરેબિયા, જેઓ લાંબા સમયથી ભારતે તેમની જરૂરિયાતોને પહોંચી ભારતના સૌથી મોટા તેલ સપ્લાયર વળવા માટે હવે તેલ ખરીદીની નવી હતા, તેમને મોટા પાયે નુકસાન થયું પેટર્ન શરુ કરતા હવે ગલ્ફ દેશો બાદ 🛮 છે. હવે ભારતના તેલ સપ્લાયરની રશિયા સૌથી મોટા તેલ સપ્લાયર યાદીમાં રશિયા બાદ ઈરાક બીજા ક્રમે જયારે સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે ચીન અને અમેરિકા પછી ભારત પહોંચી ગયું છે. જો આખા વર્ષના વિશ્વમાં ત્રીજો સૌથી મોટો તેલનો આંકડાઓ પર નજર કરીએ તો આયાતકાર દેશ છે ત્યારે ભારત માટે ૨૦૨૩માં ભારતની તેલની એક સમયે ઈરાક અને સાઉદી ખરીદીમાં એકંદરેવધારો થયો છે. વર્ષ અરેબિયા જેવા ગલ્ફના દેશો ૨૦૨૩માં ભારતે પ્રતિ દિવસ પરંપરાગત રીતે તેલ વેચનાર સૌથી સરેરાશ ૪૬.૫ લાખ બેરલ તેલની મોટા સપ્લાયર હતા ત્યારે હવે ખરીદી કરી હતી, જે ૨૦૨૨ની તુલનામાં ૨ ટકા વધુ છે.

મોત થયા હતા. આતંકવાદીઓના ચિંતાનો વિષય છે.

બળવાખોરોએ યુએસની માલિકીના ટેક્રર જહાજ પર બે એન્ટિ-શિપ બેલેસ્ટિક મિસાઇલો ફાયર કરી. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે

કે નુકસાન થયું ન હતું. ત્રણ દિવસમાં તેઓ આ પ્રદેશમાં મહત્વપૂર્ણ દરિયાઈ કોમર્શિયલ શિપિંગ શિપ પર હુથી માર્ગો પરના વિકાસ પર નજર રાખી આતંકવાદીઓ દ્વારા આ ત્રીજો હુમલો રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે હુથી બળવાખોરો ફરી એકવાર, હુથી લાલ સમુદ્રમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવી રહ્યા છે, જેનાથી વૈશ્વિક ચિંતા વધી રહી છે. બુધવારે રાત્રે એડનના અખાતમાં માર્શલ કૂંએ જહાજની નજીકના પાણીમાં ટાપુઓના ધ્વજવાળા વાણિજિયક મિસાઇલોને અસર કરતી જોઈ હતી. જહાજ પર ડ્રોન હુમલા બાદ ભારતીય હાલમાં જહાજમાં કોઈ નુકસાન થયું નૌકાદળનું મિસાઇલ વિનાશકોંદ્રજી હોવાની કોઈ માહિતી નથી. વહાણ વિશાખાપટ્ટનમ તરત જ મદદ માટે આગળ વધવાનું ચાલ રાખે છે. લાલ આગળ આવ્યું. જહાજમાં ૨૨ ક્રૂ સમુદ્રમાં છેલ્લા ઘણા દિવસોથી તણાવ મેમ્બર સવાર હતા, જેમાં નવ છે, તો બીજી તરફ પાકિસ્તાન અને ભારતીયો પણ હતા. અમેરિકા અને ઈરાનમાં પણ તણાવ વધી રહ્યો છે. બ્રિટને પહેલાથી જ યમનમાં હતી ઈરાને મંગળવારે પાકિસ્તાનના સ્થાનોને નિશાન બનાવીને હવાઈ બલ્ચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી હુમલા શરૂ કરી દીધા છે. વિદેશ સંગઠન જૈશ અલ-અદલના અકા પર મંત્રાલયના પ્રવક્તા રણધીર હુમલો કર્યો હતો, જેમાં બે બાળકોના જયસ્વાલે કહ્યું કે, આ અમારા માટે

વૈશ્વિક વેપારને અવરોધતા

લાલ સમુદ્રમાં તણાવ વધ્યો

કે, ઈરાન-સાથી હુથી મિલિશિયાએ પાકિસ્તાનની કાર્યવાહી બાદ

ગુરુવારે રાત્રે અમેરિકી માલિકીના તમામની નજર ઈરાન પર છે. તે

વૈશ્વિક વેપારને અવરોધતા હુમલાથી પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું

હતું. ૨૪ કલાક પછી તેણે ઈરાનના

સરવાન શહેરમાં હવાઈ હુમલો કર્યો.

આગળ શું પગલું ભરશે તેના પર

સમગ્ર વિશ્વની નજર છે. ભારતે

ગુરુવારે લાલ સમુદ્રમાં સુરક્ષાને લઈને

ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે

### ASHNISHA INDUSTRIES LIMITED

Registered Office. 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Ahmedabad 380 006. CIN:L74110GJ2009PLC057629

STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2023 ( Rs. In Lakhs)							
Particulars	Quarter ending	Previous Quarter ending	Corresponding 3 months ended in the previous year	Year to date			
	31-12-2023	30-09-2023	31-12-2022	31-12-2023			
	Unaudited	Unaudited	Unaudited	Unaudited			
Total income from operations	121.59	255.05	335.19	643.63			
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	26.84	30.96	14.38	89.18			
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or							
Extraordinary items)	26.84	30.96	14.38	89.18			
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or							
Extraordinary items)	19.84	24.08	14.38	75.30			
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	19.84	24.08	14.38	75.30			
Equity Share Capital	990.00	990.00	990.00	990.00			
Earnings Per Share (before extraordinary items) (of Rs. 1/- each)							
(not annualised)							
Basic:	0.020			0.076			
Diluted:	0.020	0.024	0.015	0.076			
Earnings Per Share (after extraordinary items) (of Rs. 1/- each) (not annualised)							
Basic :	0.020	0.024	0.015	0.076			
Diluted :	0.020	0.024	0.015	0.076			

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2023

<b>Control of the Control of the Contr</b>								
			(	Rs. In Lakhs)				
Particulars	Quarter ending	Previous Quarter ending	Corresponding 3 months ended in the previous year					
	31-12-2023	30-09-2023	31-12-2022	31-12-2023				
	Unaudited	Unaudited	Unaudited	Unaudited				
tal income from operations	105.52	204.31	157.29	527.47				
et Profit / (Loss) for the period before tax (after Exceptional and/or								
traordinary items)	24.03	27.82	30.21	82.09				
ofit after tax	23.05	22.01	30.21	75.30				

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.ashnisha.in)

> For. ASHNISHA INDUSTRIES LIMITED SD/-ASHOK C. SHAH MANAGING DIRECTOR DIN: 02467830